

16 જુલાઈ 2018

જુલાઈ 22ના રોજ ફ્રી આવે છે ગાર્ડન સ્ક્વેરમાં સ્ટોમ્પ એન'સ્ટેમ્પિડ

બ્રમ્પટન, ઓન્ટારિયો – બ્રમ્પટનના ગાર્ડન સ્ક્વેરમાં જુલાઈ 22ના રોજ સાંજે 4-8 બધી જ દેશી વસ્તુઓ સાથે ઉજવણી થશે. ભૂલકાઓની પ્રવૃત્તિઓ, લજ્જતદાર પકવાનો, સંગીત અને નૃત્ય માટે પધારો તમારી કાઓબોય હેટ્સ અને બૂટ લઈને ડાઉનટાઉન બ્રમ્પટનમાં. ડીજે જોડની રિવેક્સ કન્ટ્રી મ્યુઝિક તરીકે ઓળખાતા તળપદી સંગીતના સૂરો રેલાવશે અને તમે વેસ્ટ કોસ્ટ શફલ શીખશો, અને ડબલ ટ્રબલ લાઈન ડાન્સરો પાસેથી લાઈન ડાન્સિંગના પાઠ ભણશો.

આ વર્ષે સ્ટોમ્પ એન'સ્ટેમ્પિડમાં મુખ્ય આકર્ષણ હશે સશા વિસાજી જેઓ દ નેક્સ્ટ કન્ટ્રી મ્યુઝિક સ્ટારના 2016ના વિજેતા છે. સશા વગાડશે બે સેટ્સ, સાંજે 06:15 વાગ્યે અને સાંજે 07:30 વાગ્યે.

આ ઉનાળે, તમારી કન્ટ્રી પાર્ટીનું સ્થળ છે ગાર્ડન સ્ક્વેર, જે ડાઉનટાઉન બ્રમ્પટનની ગતિશીલ, ક્રિયાશીલ જાહેર જગ્યા છે. સ્ટોમ્પ એન'સ્ટેમ્પિડ વિશે વધુ જાણવા અને ગાર્ડન સ્ક્વેરના કાર્યક્રમો વિશે સંપૂર્ણ વિગતો માટે અહીં મુલાકાત લો

www.brampton.ca/gardensquare અથવા સોશયલ પર ફોલો કરો:

[instagram.com/garden.square](https://www.instagram.com/garden.square) • twitter.com/gardensqlive • facebook.com/brampton.gardensquare

ક્વોટ:

“ગાર્ડન સ્ક્વેરના ઉનાળાના ઈવેન્ટ્સ આપણા તમામ રહીશો માટે કેટલી બધી વસ્તુઓ લાવ્યા છે. લોકપ્રિય સ્ટોમ્પ એન'સ્ટેમ્પિડ દરેક જાણમાંથી તેમનું 'તળપદાપાણું' બહાર લાવે છે. સ્ક્વેર ખાતે પધારો અને આ રાહ જોવાઈ રહી હતી એવા કન્ટ્રી ઈવેન્ટમાં સહભાગી થાવ.”

- મેયર લિન્ડા જેફી

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com) અને [Facebook](https://facebook.com) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.